

રાજકોટ મહાનગરપાલિકા
સેક્રેટરીશ્રીની કચેરી

“માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫”

પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર (૧૭ મુદ્દા)ની માહિતી

સને ૨૦૧૭-૧૮

-: સેક્રેટરીશ્રીની કચેરી :-
પ્રકરણ-૨(નિયમ સંગ્રહ-૧)

સંગઠનની વિગતો કાર્યો અને ફરજો

૨ : ૧ જાહેર તંત્ર ઉદ્દેશ/ હેતુ :-

૨:૧ ધી બી.પી.એમ.સી. એકટની જોગવાઈઓ અનુસાર તથા જનરલ બોર્ડ તથા સ્થાયી સમિતિ દ્વારા નક્કી કરેલ નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.

૨:૨ જાહેર તંત્રનું મિશન દુરંદેશીપણું (વિઝન) :-

૨:૨ લાગુ પડતું નથી.

૨: ૩ જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ :-

૨:૩ તા.૧૯/૧૧/૧૯૭૩થી નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયેલ છે. મહાનગરપાલિકામાં રૂપાંતર થતા, શહેરના વિકાસ કામો નીતિવિષયક નિર્ણયો, સત્તાઓ વિગેરે માટે સક્ષમ ઓથોરિટી દ્વારા રજૂ થતી દરખાસ્તો જરૂરી ઠરાવો તૈયાર કરી, સક્ષમ કમિટિઓ જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓમાં નિર્ણય કરાવી, સક્ષમ ઓથોરિટીને અમલવારી/નિર્ણય અર્થે પ્રમાણિત નકલો મોકલવાની મહાનગરપાલિકાની રચના બાદ ધી.બી.પી.એમ.સી. એકટની કલમ -૪૮ અનુસાર અલગ અસ્તિત્વ અને સ્ટાફની અલગ સિનિયોરીટી અસ્તિત્વમાં આવેલ છે. તેમજ જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ તથા ખાસ સમિતિઓની અસલ પ્રોસીડિંગ બુક-અસલ ઠરાવ કાયમી રેકર્ડ તરીકે નિભાવવામાં આવે છે.

૨:૪ જાહેર તંત્રની ફરજો :-

૨:૪ ---- ઉપર મુજબ ----

૨:૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ/ કાર્યો :-

૨:૫ જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ તથા ખાસ સમિતિઓની મીટિંગ બોલાવવી, એજન્ડા પ્રસિધ્ધ કરવા, પ્રોસીડિંગ લખવી તેમજ અસલ ઠરાવ કાયમી રેકર્ડ તરીકે નિભાવવા.

- ૨:૬ જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ :-
- ૨:૬ સક્ષમ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણયોના ઠરાવની નકલો તૈયાર કરવી. અરજીઓના અનુસંધાને સક્ષમ ઓથોરિટી દ્વારા મંજૂરી મળ્યા બાદ ઠરાવની ખરી નકલો તૈયાર કરી, મોકલવામાં આવે છે.
- ૨:૭ જાહેર તંત્રના નિયામક કચેરી, પ્રદેશ જિલ્લો, બ્લોક વિગેરે સ્તરોએ સંસ્થાગત માળખાનો આલેખ (જ્યાં લાગુ પડતો હોય ત્યાં) :-
- ૨:૭ લાગુ પડતું નથી.
- ૨:૮ જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :-
- ૨:૮ ચુંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા સૂચવવામાં આવતા સુચનોની અમલવારી માટે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત જનરલ બોર્ડની મીટિંગની કાર્યવાહીની જાણકારી શહેરના નાગરિકોને મળી રહે તે માટે મીટિંગ હોલમાં, પ્રેક્ષક ગેલેરીની બેઠક સંખ્યાની મર્યાદામાં, પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન આપવામાં આવે છે.
- ૨:૯ લોક સહયોગ મેળવવા ગોઠવણ અને પદ્ધતિઓ :-
- ૨:૯ સામાન્ય સભા, સ્થાયી સમિતિ, બાંધકામ સમિતિ, વોટર વર્કસ સમિતિ, લાઈટીંગ સમિતિ, બાગ બગીચા અને ઝૂ સમિતિ, કાયદો અને નિયમોની સમિતિ, ડ્રેનેજ સમિતિ, પ્લાનીંગ સમિતિ, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ, આરોગ્ય સમિતિ, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ, સેનિટેશન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, માર્કેટ સમિતિ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ સહિતની સમિતિઓ દ્વારા થયેલ ઠરાવોને સક્ષમ ઓથોરિટી દ્વારા મંજૂરી મળ્યા બાદ, નિયમ મુજબ, નાગરિકોને ખરી નકલ આપવામાં આવે છે.
- ૨:૧૦ સેવા આપવા દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર :-

- ૨:૧૦ સામાન્ય સભા, સ્થાયી સમિતિ અને ખાસ સમિતિઓ દ્વારા થયેલા ઠરાવો, મંજૂરી મળ્યા બાદ નિયમ મુજબ, નાગરિકોને ખરી નકલ આપવામાં આવે છે.
- ૨:૧૧ મુખ્ય કચેરી અને જુદા-જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના સરનામા (વપરાશકારને-સમજવામાં સરળ પડે તે માટે જિલ્લા વાર વર્ગીકરણ કરો) :-
- ૨:૧૧ મ્યુનિસિપલ સેક્રેટરીશ્રીની કચેરી, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ
- ૨:૧૨ કચેરી શરૂ થવાનો સમય :-
- ૨:૧૨ સવારે ૧૦:૩૦ કલાકે
- ૨:૧૨ કચેરી બંધ થવાનો સમય :-
- ૨:૧૨ સાંજે ૬:૧૦ કલાકે -ઉપરાંત મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી વિગેરે પદાધિકારીઓ પોતાની કચેરીઓમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી.

મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી :- અધિકારીઓ/ કર્મચારીઓની સત્તા અને ફરજ (પ્રકરણ:૩ નિયમ સંગ્રહ-૨)

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
૦૧	મ્યુનિસિપલ સેક્રેટરી	ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૪૮	બજેટ જોગવાઈને આધીન રહીને ખર્ચ મંજૂર કરવાની સત્તા	ધી બી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ તેમજ પ્રવર્તમાન કાયદા મુજબ	(૧) ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ કલમ-૪૮ હેઠળ. (૨) ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ કલમ-૫૬(૧) ધ હેઠળ. (૩) ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ કલમ-૬૭(ખ) હેઠળ (૪) ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ના પ્રકરણ-૨ અનુસાર. (૫) ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ના પ્રકરણ-૫ ખ (૨).
		(ક) કોર્પોરેશન અને સ્થાયી સમિતિ અનુક્રમે પોત પોતાના સબંધી તેને ફરમાવે તેવી બીજી ફરજો બજાવવી.			
		(ખ) કોર્પોરેશન અને ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ-૩૦ અથવા ૩૧ મુજબ કોર્પોરેશનને નિમેલી કોઈપણ સમિતિની (૨) સ્થાયી સમિતિ અને તેની કોઈપણ પેટા સમિતિની કાર્યવાહીઓ સાથે સબંધ ધરાવતા સઘળા કાગળો અને દસ્તાવેજો કસ્ટડીમાં રાખવા.			
		(ગ) સ્થાયી સમિતિ વખતો વખત કરે તેવા નિર્દેશોને આધીન રહીને તેના સીધા તાબા હેઠળના અધિકારીઓ અને નોકરોની ફરજો ઠરાવવી અને			

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
		<p>(ઘ) સ્થાયી સમિતિના હુકમોને આધિન રહીને સદરહું અધિકારીઓ અને નોકરોના કોર્પો અને કાર્યવાહીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવું અને વિનિયમોને આધીન રહીને સદરહું અધિકારીઓ અને નોકરોની નોકરી, મહેનતાણું અને વિશેષધિકારોને લગતા સઘળા પ્રશ્નનો નિકાલ કરવો.</p> <p>ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ના પ્રકરણ ૨ મુજબ, કોર્પોરેશન, સ્થાયી સમિતિ વિગેરેની કાર્યવાહીઓ.</p> <p>ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૫૩(૨),૫૬ (૧)(ઘ) તથા કલમ-૬૭(ખ)</p>			
૦૨	ડેપ્યુટી સેક્રેટરી	-	-	-	ઓફીસર્સ સિલેક્શન કમિટીના એજન્ડા ઠરાવો તૈયાર કરવા, મીટિંગમાં હાજરી આપવી તથા જનરલ બોર્ડની કામગીરીમાં મદદગારી કરવી, પેટા કમિટીઓને લગત કામગીરી કરવી, સેક્રેટરીશ્રી તરફથી સુપ્રત થતી કામગીરી કરવી, સ્ટાફનું મુવમેન્ટ

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
					રજીસ્ટર નિભાવવુ, સેક્રેટરીશ્રીની કચેરીના તમામ સ્ટાફની કામગીરી ઉપર જનરલ સુપરવિઝનની કામગીરી, તેમજ ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી બજાવવી.
03	આસી. સેક્રેટરી	-	-	-	સ્થાયી સમિતિને લગત કામગીરીમાં મદદ કરવી, જનરલ બોર્ડ પ્રોસીડિંગ બુકની કામગીરી સ્ટાફ ઈન્કમટેક્સ લગત ફોર્મ તથા માહિતી તૈયાર કરવી, મેયરશ્રી, ડે.મેયરશ્રી તથા સ્ટે.ક.ચેરમેનશ્રીના પ્રવાસ અંગેની ફાઈલો રાખવી. બજેટ, ડાયરી તેમજ વાર્ષિક અહેવાલની માહિતી તૈયાર કરી મોકલવી. પેટા કમિટી લગત કામગીરી, ઠરાવો તૈયાર કરવા વિગેરે તમામ કામગીરી તથા સ્ટાફ સુપરવીઝન તેમજ ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી બજાવવી.

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
૦૪	સ્ટેનો ટુ મેયર (ગુજરાતી)	-	-	-	મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ તેમજ ઉચ્ચ અધિકારી પાસેથી ડીકટેશન લઈ પત્રો ટાઈપ કરવા જ.બો., સ્થાયી સમિતિ, ખાસ સમિતિ ઓના જરૂર પડયે પરિપત્રો, ઠરાવો ટાઈપ કરવા, મેયરશ્રીની તમામ ફાઈલો, મેયરશ્રીની સુચના મુજબની કામગીરી કરવી, કોમ્પ્યુટર ઓપરેટ કરવું અને તેની જાળવણીનું ધ્યાન આપવું ઉપરાંત ઉપરી અધિકારી તરફથી સુપ્રત કરવામાં આવે તે તમામ કામગીરી બજાવવી.
૦૫	હેડ ક્લાર્ક	-	-	-	સ્થાયી સમિતિના ઠરાવો તૈયાર કરવા, સરકારી ગેઝેટોની ફાઈલો નિભાવવી. કચેરીના સંકલનની કામગીરી, જનરલ બોર્ડની કામગીરી, સ્થાયી સમિતિની પ્રોસીડિંગ બુકની કામગીરી તેમજ પેટા કમિટી લગત કામગીરી, સ્ટાફ સુપરવિઝન તેમજ ઉપરી અધિકારીઓ તરફથી સોંપવામાં આવતી કામગીરી, સ્ટાફ, સભ્યશ્રીઓના

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
					માનદ વેતનના બીલ બનાવવા તથા યુકવવાની કામગીરી, શાખાના વાઉચર બીલો બનાવવા, ચૂકવવા, સ્ટાફ મહેકમ એસ્ટાબ્લીસમેન્ટની કામગીરી, ઠરાવોની ખરી નકલ તૈયાર કરાવવી તેમજ પેટા કમિટીઓ ઠરાવો વિગેરે તૈયાર કરવા તેમજ જનરલ બોર્ડ, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓના પરિપત્રો ઠરાવો કમ્પેર કરાવવા તથા ઉપરી અધિકારીશ્રીઓ તરફથી સુપ્રત કરવામાં આવતી તમામ કામગીરી બજાવવી.
૦૬	સિનિયર ક્લાર્ક				ટપાલો સ્વીકારવી, જાવક રજીસ્ટર, પોસ્ટ રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર, સ્ટેશનરી રજીસ્ટર, ફુડ, ફેસ્ટીવલ લોન રજીસ્ટર વિગેરે નિભાવવા તેમજ જનરલ બોર્ડ, સ્ટેલિંગ કમિટી તથા ખાસ સમિતિઓના ઠરાવો પરિપત્રો વિગેરે કમ્પેર કરાવવા, મેયરશ્રી, સ્ટેલિંગ કમિટી ચેરમેનશ્રીની તથા શાખાને લગત ફાઈલીંગ કામગીરી કરવી તથા

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
					નિભાવવી, પેટા કમિટીઓની કામગીરી તેમજ ઉપરી અધિકારીશ્રીઓ તરફથી સુપ્રત થતી તમામ કામગીરી બજાવવી.
૦૭	જુનિયર કલાર્ક	-	-	-	ટપાલો સ્વીકારવી, જાવક રજીસ્ટર, પોસ્ટ રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર, સ્ટેશનરી રજીસ્ટર, ફુડ, ફેસ્ટવલ લોન રજીસ્ટર વિગેરે નિભાવવા તેમજ જનરલ બોર્ડ, સ્ટેલિંગ કમિટી તથા ખાસ સમિતિઓના ઠરાવો પરિપત્રો વિગેરે કમ્પેર કરાવવા. મેયરશ્રી, સ્ટેલિંગ કમિટી ચેરમેનની તથા શાખાને લગત ફાઈલીંગ કામગીરી તથા નિભાવવી. પેટા કમિટીઓની કામગીરી તેમજ ઉપરી અધિકારીશ્રીઓ તરફથી સુપ્રત થતી તમામ કામગીરી બજાવવી.
૦૮	નાયક	-	-	-	મેયરશ્રીની ચેમ્બર પાસે ફરજ બજાવવી તથા સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓના એજન્ડા બજાવવા તેમજ અન્ય કચેરીઓની ટપાલો, પ્રેસ યાદી પહોચાડવી વિગેરે

ક્રમ	હોદ્દો	વહીવટી સત્તાઓ	નાણાકીય સત્તાઓ	અન્ય સત્તા	ફરજ
					આઉટડોરની કામગીરી તથા ઓફીસ તરફથી સુપ્રત કરવામાં આવતી તમામ કામગીરી, પટાવાળાની સુપરવિઝનની કામગીરી.
૦૯	પટાવાળા	-	-	-	મેયરશ્રી, ડે. મેયરશ્રી, સેક્રેટરીશ્રીની કચેરી, શાસક પક્ષ કાર્યાલય, વિરોધ પક્ષ કાર્યાલય સેક્રેટરીશ્રીના સ્ટાફ રૂમ વિગેરેની ફરજ બજાવવી, સ્થાયી સમિતિ, ખાસ સમિતિઓના એજન્ડા, અન્ય કચેરીની ટપાલો, પ્રેસ યાદી વિ. કામગીરી તેમજ ઓફીસ તરફથી સુપ્રત કરવામાં આવતી તમામ કામગીરી.

પ્રકરણ - ૪ (નિયમ સંગ્રહ- ૩) ના પત્રકની નકલ

ક્રમ	દસ્તાવેજનું નામ	દસ્તાવેજનો પ્રકાર	દસ્તાવેજ પરનું ટુંકુ લખાણ
૧	જનરલ બોર્ડની પ્રોસીડિંગ બુક	કાયમી	જનરલ બોર્ડની પ્રોસીડિંગ બુક
૨	સ્ટેન્ડિંગ કમિટીની પ્રોસીડિંગ બુક	કાયમી	સ્ટેન્ડિંગ કમિટીની પ્રોસીડિંગ બુક
૩	ખાસ સમિતિઓની પ્રોસીડિંગ બુક	કાયમી	ખાસ સમિતિઓની પ્રોસીડિંગ બુક
૪	વહીવટીદારશ્રીના ઠરાવો	કાયમી	વહીવટીદારશ્રીના ઠરાવો
૫	જનરલ બોર્ડના ઠરાવો	કાયમી	જનરલ બોર્ડના ઠરાવો
૬	સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવો	કાયમી	સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવો
૭	ખાસ સમિતિઓના ઠરાવો	કાયમી	ખાસ સમિતિઓના ઠરાવો
૮	જાવક રજીસ્ટર	રેકર્ડ વર્ગીકરણ નિયમાનુસાર	
૯	આવક રજીસ્ટર	રેકર્ડ વર્ગીકરણ નિયમાનુસાર	
૧૦	તદર્થ સમિતિની ફાઈલો		

પ્રકરણ- ૫ (નિયમસંગ્રહ-૪)

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે
સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય
તો તેની વિગત

નીતિ ઘડતર :-

૫.૧ શું નીતિઓના ઘડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/
સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો, નીચેના નમુનામાં આવી
નીતિની વિગતો આપો.

અનુ. નં.	વિષય/ મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે? (હા/ ના)	જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા
૧	નીતિના ઘડતર સંબંધિત	હા	સામાન્ય ચૂંટણી દ્વારા સભ્યો ચુંટવા

આનાથી નાગરિકને, કયા કાયદાના આધારે, નીતિવિષયક બાબતોના ઘડતર અને
અમલમાં જનતાની સહભાગિતા નક્કી કરાઈ છે તે સમજવામાં મદદ થશે.

નીતિઓનો અમલ :-

પ.૨ શું નીતિઓના અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધિઓની સલાહ- પરામર્શ/ સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો હોય તો, આવી જોગવાઈઓની વિગતો નીચેના નમૂનામાં આપવો.

અનુ. નં.	વિષય/ મુદ્દો	શું જનતાની સહભાગિતા સુનિશ્ચિત કરવાનું જરૂરી છે ? (હા/ ના)	જનતાની સહભાગિતા મેળવવા માટેની વ્યવસ્થા
લાગુ પડતું નથી.			

પ્રકરણ- ૬ (નિયમસંગ્રહ- ૫)

જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની

કક્ષાઓ અંગેનું પત્રક

૬.૧ સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમૂનાઓ ઉપયોગ કરશો. જ્યાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા, નિયામકશ્રી કચેરી કક્ષા, અન્યનો પણ ઉલ્લેખ કરો. ('અન્યો' લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો).

અનુ. નં.	દસ્તાવેજની કક્ષા	દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે/ તેના નિયંત્રણમાં છે.
૧	જનરલ બોર્ડના ઠરાવો	ઠરાવો	કોર્પો. એ નિયત કરેલ કાર્ય પદ્ધતિ	સેક્રેટરીશ્રીની કચેરી
૨	સ્ટે. કમિટીના ઠરાવો	ઠરાવો	કોર્પો. એ નિયત કરેલ કાર્ય પદ્ધતિ	સેક્રેટરીશ્રીની કચેરી
૩	ખાસ સમિતિના ઠરાવો	ઠરાવો	કોર્પો. એ નિયત કરેલ કાર્ય પદ્ધતિ	સેક્રેટરીશ્રીની કચેરી
૪	વહીવટીદારશ્રીના ઠરાવો	ઠરાવો	કોર્પો. એ નિયત કરેલ કાર્ય પદ્ધતિ	સેક્રેટરીશ્રીની કચેરી

પ્રકરણ-૭(નિયમસંગ્રહ-૭)

તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

૭.૧ જાહેર તંત્રને લગતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમૂનામાં આપો :

માન્યતા, પ્રાપ્ત સંસ્થાનું નામ અને : રાજકોટ મહાનગરપાલિકા,
સરનામું ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ,
રાજકોટ

માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, : બોર્ડ
પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો)

માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટૂંકો પરિચય : તા.૧૯/૧૧/૧૯૭૩ના રોજ (મહા
(સંસ્થાપના વર્ષ, ઉદ્દેશ/ મુખ્ય નગરપાલિકામાં રૂપાંતર) લોક
પ્રવૃત્તિઓ) સુખાકારીના કાર્યો

માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા : સંચાલક
(સલાહકાર સંચાલક/ કાર્યકારી/
અન્ય)

માળખું અને સભ્ય બંધારણ : (ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯) ધી
બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ
કોર્પોરેશન એક્ટ-૧૯૪૯

સંસ્થાના વડા : મેયરશ્રી/વહીવટીદારશ્રી

મુખ્ય કચેરી અને તેની શાખાઓના : ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ,
સરનામા રાજકોટ

બેઠકોની સંખ્યા : ૭૨

શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે : હા (પ્રેક્ષક કક્ષમાં, નિયમોનુસાર)
?

શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં : હા
આવે છે ?

બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ : ના
છે? જો તેમ હોય તો તે મેળવવા
માટેની પદ્ધતિની માહિતી આપો

પ્રકરણ- ૮ (નિયમસંગ્રહ- ૭)

સરકારી માહિતી અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો

૮.૧ જાહેર તંત્રના સરકારી માહિતી અધિકારીઓ, મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ અને વિભાગીય કાયદાકીય (એપેલેટ) સત્તાધિકારી વિશેની સંપર્ક માહિતી નીચેના નમૂનામાં આપો.

સરકારી તંત્રનું નામ :જાહેર માહિતી અધિકારીઓ :

અનુ. નં.	નામ	હોદ્દો	એસ. ટી.ડી. કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	શ્રી એચ.પી. રૂપારેલીઆ	મ્યુનિ. સેક્રેટરીશ્રી	૦૨૮૧	૨૨૨૧૫૨૧	-	૦૨૮૧-૨૨૨૩૯૧૫	hprupa-relia@rmc.gov.in sec@rmc.gov.in	સેક્રેટરીશ્રીની કચેરી, રાજકોટ મહાનગરપાલિકા

એપેલેટ અધિકારીઓ

અનુ. નં.	નામ	હોદ્દો	એસ. ટી.ડી. કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	શ્રી આર .જે હાલાણી	ડેપ્યુટી કમિશનર	૦૨૮૧	૨૩૩૧ ૪૮૪	-	૨૨૨૪૨૫૮	dmcez@rmc.gov.in	વેસ્ટ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા

વિભાગીય એપેલેટ (કાયદા) સત્તાધિકારી

અનુ. નં.	નામ	હોદ્દો	એસ. ટી.ડી. કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	શ્રી બંધાનિધિ પાની I.A.S.	મ્યુનિ. કમિશનર	૦૨૮૧	૨૨૨૪૧૩૩		૨૨૨૪૨૫૮	mc@rmc.gov.in	રાજકોટ મહાનગરપાલિકા

પ્રકરણ- ૯

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય પદ્ધતિ

- ૯.૧ ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ તથા ધી બી.સી.એસ.આર. ની જોગવાઈ અનુસાર નિર્ણયો લેવામાં આવે છે.
- ૯.૨ સેક્રેટરીશ્રીની કચેરીના અધિકારીઓ/કર્મચારીઓના પગારઘોરણ, ઇન્ક્રીમેન્ટ, મોંઘવારી, મુસાફરી ભથ્થા, પેન્શન, ગ્રેયુઈટી, કોમ્પ્યુટેશન તથા નિવૃત્તિના સમયે લેણા નીકળતા હક્ક હિસ્સા સહિતની કર્મચારીને લગતી બાબતો સરકારશ્રીના નિયમાનુસાર કરવામાં આવે છે.
- ૯.૩ સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતુ નથી.
- ૯.૪ મ્યુનિસિપલ સેક્રેટરીશ્રી
- ૯.૫ મ્યુનિસિપલ સેક્રેટરીશ્રી
- ૯.૬ સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતુ નથી.

પ્રકરણ- ૧૦

અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડિરેક્ટરી)

૧૦.૧ નીચેના નમૂનામાં જિલ્લાવાર માહિતી આપો :

અનુ નં.	નામ	હોદ્દો	એસ.ટી. ડી. કોડ	ઝોન નંબર		ફેકસ	ઈ- મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
સામેલ પત્રક મુજબ								

પ્રકરણ- ૧૦

સેક્રેટરીશ્રીની કચેરી (ડિરેક્ટરી)

ક્રમ નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	એસ.ટી .ડી કોડ નં.	ફોન નંબર			મોબાઈલ નંબર	ઈ-મેઈલ, ફોન	સરનામું
				કચેરી	નિવાસ સ્થાન	ફેક્સ			
૦૧	શ્રી હરીશ પી. રૂપારેલીઆ	સેક્રેટરી	૦૨૮૧	૨૨૨૧૫૨૧	-	૨૨૨૩૯૧૫	૯૭૧૪૫૦૩૭૨૧	hpruparelia@mc.gov.in sec@rmc.gov.in	સેક્રેટરીશ્રીની કચેરી, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ
૦૨	શ્રી છબીલદાસ એન. રાણપરા	ડેપ્યુટી સેક્રેટરી	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૭૧૪૫૦૩૭૧૧	cnranpara@yahoo.com	ઉપર મુજબ
૦૩	શ્રી કનૈયાલાલ એચ. હિન્ડોયા	ડેપ્યુટી સેક્રેટરી (ફિક્સ પગાર)	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૭૨૩૪૫૭૫૮૦	-	ઉપર મુજબ
૦૪	શ્રી હસમુખ જે. વ્યાસ	સિની. ક્લાર્ક	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૬૨૪૦૧૯૫૭૮	-	ઉપર મુજબ
૦૫	શ્રી રાજેશ એ. દૂધરેજિયા	જુ.ક્લાર્ક	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૬૨૪૭૬૫૬૫૮	-	ઉપર મુજબ

ક્રમ નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	એસ.ટી .ડી કોડ નં.	ફોન નંબર			મોબાઈલ નંબર	ઈ-મેઈલ, ફોન	સરનામું
				કચેરી	નિવાસ સ્થાન	ફેક્સ			
૦૬	શ્રી મયુર આર.ચાવડા	જુ.ક્લાર્ક	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૭૨૩૪ ૫૮૮૨૨	-	ઉપર મુજબ
૦૭	શ્રી જયદીપસિંહ પી.પરમાર	જુ.ક્લાર્ક	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૯૨૪૮ ૭૦૭૫૬	-	ઉપર મુજબ
૦૮	શ્રી રાહુલ એમ. પરમાર	નાયક	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૭૨૩૪ ૫૨૯૦૬	-	ઉપર મુજબ
૦૯	શ્રી વસંતબેન જે. ઠાકર	પદ્માવાળા	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	-	-	ઉપર મુજબ
૧૦	શ્રી દિલીપ વી. નકુમ	પદ્માવાળા	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	-	-	ઉપર મુજબ
૧૧	શ્રી કુરજી એચ.સાવલીયા	પદ્માવાળા	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	-	-	ઉપર મુજબ
૧૨	શ્રી ઉમેશ ડી.કુંડલીયા	મજુર	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૭૨૩૪ ૫૬૨૩૩	-	ઉપર મુજબ
૧૩	શ્રી જયેશ ટી. વાઘેલા	મજુર	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૭૨૬૩ ૯૬૯૭૦	-	ઉપર મુજબ

ક્રમ નં.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	એસ.ટી .ડી કોડ નં.	ફોન નંબર			મોબાઈલ નંબર	ઈ-મેઈલ, ફોન	સરનામું
				કચેરી	નિવાસ સ્થાન	ફેક્સ			
૧૪	શ્રી રમેશ એસ.પરમાર	પટ્ટાવાળા	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૮૧૪૦૫ ૨૨૨૦૨	-	ઉપર મુજબ
૧૫	શ્રી રાઘવજી બી. બાબરીયા	હેલ્પર	૦૨૮૧	-	-	-	-	-	ઉપર મુજબ
૧૬	શ્રી કલ્પેશ એમ. ગોહેલ	મજૂર	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૬૨૪૯ ૭૫૮૭૨	-	ઉપર મુજબ
૧૭	શ્રી કૌશિક બી.સોલંકી	પટ્ટાવાળા	૦૨૮૧	૨૨૨૧૫૨૩	-	-	૯૮૨૪૮ ૬૧૯૪૦	-	ઉપર મુજબ

પ્રકરણ-૧૧ (નિયમસંગ્રહ- ૧૦)

વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને

મળતું માસિક મહેનતાણું

૧૧.૧ નીચેના નમૂનામાં માહિતી આપો.

ક્રમ નં.	નામ	હોદ્દો	માસિક મહેનતાણું	વળતર/ વળતર ભથ્થું	વિનિયમમાં જણાવ્યા મુજબ મહેનતાણું નકકી કરવાની કાર્યપદ્ધતિ
સામેલ પત્રક મુજબ					

સેક્રેટરીશ્રીની કચેરીના કર્મચારીઓની માહિતી પત્રક (એપ્રિલ-૨૦૧૭)

૧૧.૧ નીચેના નમૂનામાં માહિતી

ક્રમ	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	પગાર ધોરણ (રૂ.)	કુલ માસિક પગાર(રૂ.)	રીમાર્ક્સ
૧	એચ.પી.રૂપારેલીઆ	સેક્રેટરી	૬૭૭૦૦-૨૦૮૭૦૦	૧,૦૯,૨૦૦	(લેવલ-૧૧)
૨	સી.એન. રાણપરા	ડે. સેક્રેટરી	૫૬૧૦૦-૧૭૭૫૦૦	૮૨,૬૨૧	(લેવલ-૧૦)
૩	કે.એચ. હિન્ડોયા	ડે. સેક્રેટરી	(ફિક્સ પગાર)	૫૦,૯૪૦	----
૪	એચ.જે. વ્યાસ	સીની.ક્લાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦	૪૦,૦૭૬	(લેવલ-૪)
૫	આર. એ. દૂધરેજિયા	જૂ.ક્લાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦	૪૨,૨૨૫	(લેવલ-૪)
૬	એમ. આર.ચાવડા	જૂ.ક્લાર્ક	૧૯૯૦૦-૬૩૨૦૦	૨૧,૪૩૫	(લેવલ-૨)
૭	જે. પી. પરમાર	જૂ.ક્લાર્ક	૧૯૯૦૦-૬૩૨૦૦	૨૩,૯૯૪	(લેવલ-૨)
૮	આર.એમ. પરમાર	નાયક	૧૫૦૦૦-૪૭૬૦૦	૨૯,૪૬૯	(IS-૨)
૯	વી.જે.ઠાકર	પદ્મવાળા	૧૫૭૦૦-૫૦૦૦૦	૩૨,૭૦૩	(IS-૩)
૧૦	ડી.વી. નકુમ	પદ્મવાળા	૧૫૭૦૦-૫૦૦૦૦	૩૨,૦૫૯	(IS-૩)
૧૧	કે.એચ.સાવલીયા	પદ્મવાળા	૧૫૭૦૦-૫૦૦૦૦	૩૨,૧૧૯	(IS-૩)
૧૨	યુ.ડી. કુંડલીયા	મજુર	૧૫૦૦૦-૪૭૬૦૦	૩૦,૨૩૫	(IS-૨)
૧૩	જે.ટી. વાઘેલા	મજુર	૧૫૦૦૦-૪૭૬૦૦	૨૯,૨૩૯	(IS-૨)
૧૪	આર.એસ. પરમાર	પદ્મવાળા	૧૪૮૦૦-૪૭૧૦૦	૧૮,૭૩૯	(IS-૧)
૧૫	આર.બી. બાબરીયા	હેલ્પર	૧૫૭૦૦-૫૦૦૦૦	૩૩,૨૨૫	(IS-૩)
૧૬	કે.એમ. ગોહેલ	મજુર	૧૪૮૦૦-૪૭૧૦૦	૨૦,૫૯૧	(IS-૧)
૧૭	કે.બી.સોલંકી	પદ્મવાળા	૧૫૦૦૦-૪૭૬૦૦	૩૧,૮૨૦	(IS-૨)

પ્રકરણ-૧૨ (નિયમસંગ્રહ-૧૧)

પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે

૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી નીચેના નમૂનામાં આપો.

વર્ષ ૨૦૧૪-૨૦૧૫

ક્રમ નં.	યોજનાનું નામ સદર	પ્રવૃત્તિ	પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ	પ્રવૃત્તિના અવની અંદાજેલ તારીખ	સૂચિત રકમ	મંજૂર થયેલ રકમ	છૂટી ચૂકવેલ રકમ (હપ્તાની સંખ્યા)	છેલ્લા વર્ષનું ખેરખર ખર્ચ	કાર્યની ગુણવત્તા માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી
સેક્રેટરીશ્રીની કચેરી હસ્તક કોઈ યોજનાકીય બજેટ હોતું નથી.									

અન્ય જાહેર તંત્રો માટે :

	સદર	સૂચિત અંદાજપત્ર	મંજૂર થયેલ અંદાજપત્ર	છૂટી કરેલ ચૂકવેલ રકમ (હપ્તાની સંખ્યા)	કુલ ખર્ચ(રૂ.)
સ્ટાફ પગાર ખર્ચ	૩૦૧૦૦	૭૫,૮૪,૦૦૦	૭૫,૮૪,૦૦૦	૭૫,૮૪,૦૦૦	૪,૯૧,૭૨૭
સભ્યશ્રીઓને માનદ વેતન	૩૦૯૦૧	૪૮,૦૦,૦૦૦	૪૮,૦૦,૦૦૦	૪૮,૦૦,૦૦૦	૩,૧૪,૨૫૦
આઉટ સોર્સિંગ સ્ટાફ	૩૦૧૦૧	૪,૦૦,૦૦૦	૪,૦૦,૦૦૦	૪,૦૦,૦૦૦	૨૭,૦૦૩
સાદીલવાર ખર્ચ	૩૪૦૦૦	૬,૫૦,૦૦૦	૬,૫૦,૦૦૦	૬,૫૦,૦૦૦	૩૪,૬૮૦
ટેલીફોન ખર્ચ	૩૪૧૦૦	૨,૫૦,૦૦૦	૨,૫૦,૦૦૦	૨,૫૦,૦૦૦	૧૭,૪૯૪
વીજળી ખર્ચ	૪૩૧૦૩	૧,૨૦,૦૦૦	૧,૨૦,૦૦૦	૧,૨૦,૦૦૦	૩,૫૫૫
મેયરશ્રી/સભ્યશ્રીઓને મુસાફરી ભથ્થું	૩૪૩૦૦	૫,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦	૪૨,૬૯૧
મેયરશ્રી સ્વવિવેક ગ્રાન્ટ	૩૫૧૦૨	૩,૦૦૦	૩,૦૦૦	૩,૦૦૦	----
સ્ટે. ક. ચેરમેનશ્રીને સ્વવિવેક ગ્રાન્ટ	૩૫૧૦૩	૨,૨૫,૦૦૦	૨,૨૫,૦૦૦	૨,૨૫,૦૦૦	૭,૭૦૨
વિરોધ પક્ષ નેતાશ્રીને સ્વવિવેક ગ્રાન્ટ	૩૫૧૦૪	૩,૦૦૦	૩,૦૦૦	૩,૦૦૦	---
મહેમાન સરભરા ખર્ચ	૩૪૪૦૦	૩,૨૫,૦૦૦	૩,૨૫,૦૦૦	૩,૨૫,૦૦૦	૯,૫૦૦

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ

૧૩.૧ નીચેના નમૂના મુજબ માહિતી આપો.

- કાર્યક્રમ/યોજનાનું નામ
- કાર્યક્રમ/યોજનાનો સમયગાળો
- કાર્યક્રમનો ઉદ્દેશ
- કાર્યક્રમનો ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકો (છેલ્લા વર્ષ માટે)
- લાભાર્થીની પાત્રતા
- લાભ અંગેની પૂર્વ જરૂરિયાતો
- કાર્યક્રમનો લાભ લેવાની પદ્ધતિ
- પાત્રતા નક્કી કરવા અંગેના માપદંડો
- કાર્યક્રમમાં આપેલ લાભની વિગતો (સહાયકીની રકમ અથવા આપવામાં આવેલ અન્ય મદદ પણ દર્શાવવવી.)
- સહાયકી વિતરણની કાર્યપદ્ધતિ
- અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો.
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અરજીપત્રકનો નમુનો (લાગુ પડતુ હોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શું શું દર્શાવવું તેનો ઉલ્લેખ કરો).
- બિડાણોની યાદી (પ્રમાણપત્રો/દસ્તાવેજો)
- બિડાણનો નમૂનો
- પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો.
- ઉપલબ્ધ નિધિની વિગતો (જિલ્લા કક્ષા, ઘટક કક્ષા વગેરે જેવા વિવિધ સ્તરોએ)

નીચેના નમૂનામાં લાભાર્થીઓની યાદી

ક્રમનં./ કોડ	લાભાર્થીનું નામ	સહાયકીની રકમ	માતા- પિતા/ વાલી	પસંદગીનો માપદંડ	સરનામું			
					જિલ્લો	શહેર	નગર/ ગામ	ઘર નં.
સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતુ નથી.								

પ્રકરણ-૧૪ (નિયમસંગ્રહ-૧૩)

તેણે આપેલ રાહતો, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો

નીચેના નમૂના મૂજબ માહિતી આપો.

- કાર્યક્રમનું નામ
- પ્રકાર (રાહત/પરમિટ/અધિકૃતિ)
- ઉદ્દેશ
- નકકી કરેલ લક્ષ્યાંક (છેલ્લા વર્ષ માટે)
- પાત્રતા
- પાત્રતા માટેના માપદંડો
- પૂર્વ જરૂરિયાતો
- લાભ મેળવવાની પદ્ધતિ
- રાહત/ પરમિટ/અધિકૃતિની સમય મર્યાદા
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અરજીનો નમૂનો (લાગુ પડતું હોય ત્યાં)
- બિડાણોની યાદી (પ્રમાણપત્રો/ દસ્તાવેજો)
- બિડાણનો નમૂનો.

સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતું નથી.

નીચે આપેલા નમૂનામાં લાભાર્થીની વિગતો

ક્રમનં./ કોડ	લાભાર્થીનું નામ	સહાયકીની રકમ	માતા- પિતા/ વાલી	પસંદગીનો માપદંડ	સરનામું			
					જિલ્લો	શહેર	નગર/ ગામ	ઘર નં.

રાહત માટે નીચેની માહિતી પણ આપવી.

આપેલ લાભની વિગત

લાભોનું વિતરણ

સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતું નથી.

પ્રકરણ- ૧૫ (નિયમસંગ્રહ-૧૪)

કાર્યો કરવા માટે નકકી કરેલા ધોરણો

૧૫.૧ વિવિધ પ્રવૃત્તિઓ/ કાર્યક્રમો હાથ ધરવા માટે વિભાગે નકકી કરેલ ધોરણોની વિગતો આપો.

સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતુ નથી.

प्रकरण- १५ (नियमसंग्रह-१५)

विज्ञापुत्रे उपलब्ध माहिती

१५.१ वीज्ञापुत्रे उपलब्ध विविध योजनाओनी माहितीनी विगतो आपो.

सेकेटरीश्रीनी कचेरीने लागु पऽतु नथी.

પ્રકરણ-૧૭(નિયમસંગ્રહ-૧૬)

માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સવલતોની વિગત

૧૭.૧ લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પદ્ધતિઓ અથવા સવલતો

જેવી કે,

કચેરી ગ્રંથાલય

નાટક અને શો

વર્તમાનપત્રો

પ્રદર્શનો

નોટિસ બોર્ડ

કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ- નિયમાનુસાર

દસ્તાવેજોની નકલો મેળવવાની પદ્ધતિ- નિયમાનુસાર

ઉપલબ્ધ મુદ્રિત નિયમસંગ્રહ

જાહેર તંત્રની વેબસાઈટ- www.rmc.gov.in

જાહેર ખબરના અન્ય સાધનો

બાકીની બાબતો સેક્રેટરીશ્રીની કચેરીને લાગુ પડતી નથી.